



hotel  
Excellency  
ROOM | RESTAURANT | BANQUET

📍 949-950, Shiv Shakti Market, Deesa Palanpur Highway,  
Deesa, Gujarat-385535

☎ +91 96380 98110

✉ hotelexcellencydeesa@gmail.com

🌐 www.hotelexcellencydeesa.com



hotel  
Excellency  
ROOM | RESTAURANT | BANQUET

SERVING HAPPINESS ON EVERY PLATE

## SOUP



Cream of Tomato Soup (ક્રીમ ઓફ ટોમેટો સૂપ)	100	(150ML)
Hot & Sour Soup  (હોટ એન્ડ સોર સૂપ)	110	(150ML)
Veg. Manchow Soup (વેજ. મન્ચાઉ સૂપ)	110	(150ML)
Veg. Mushroom Soup (વેજ. મશરૂમ સૂપ)	120	(150ML)
Sweet Corn Veg. Soup (સ્વીટ કોર્ન વેજ. સૂપ)	100	(150ML)
Sweet Corn Soup (સ્વીટ કોર્ન સૂપ)	110	(150ML)
Veg. Clear Soup (વેજ. ક્લીયર સૂપ)	100	(150ML)
Veg. Manchurian Soup (વેજ. મન્ચુરીયન સૂપ)	110	(150ML)
Minestrone Soup (મીનીસ્ટ્રોન સૂપ)	110	(150ML)

## SALAD / RAITA / PAPAD



Green Salad (ગ્રીન સલાડ)	80	(100GM)
Tomato Salad (ટોમેટો સલાડ)	80	(100GM)
Veg Raita (વેજ. રાઈતા)	80	(150GM)
Pineapple Raita (પાઈનેપલ રાઈતા)	110	(150GM)
Bundi Raita (બુંદી રાઈતા)	100	(150GM)
Plain Curd (પલેન દહીં)	70	(150GM)
Roasted Papad (રોસ્ટેડ પાપડ)	25	(1 PCS)
Fry Papad (ફ્રાઈડ પાપડ)	30	(1 PCS)
Masala Papad (મસાલા પાપડ)	40	(1 PCS)
Cheese Masala Papad (ચીઝ મસાલા પાપડ)	60	(1 PCS)

## CHINESE



Paneer Tikka Dry (પનીર ટીકા ડ્રાય)	250	(8 PCS)
Hara Bhara Kabab (હરા ભરા કબાબ)	220	(8 PCS)
Paneer Chilly (Dry / Gravy) (પનીર ચીલી ડ્રાય / ગ્રેવી)	210	(300GM)
Veg. Manchurian (Dry / Gravy) (વેજ. મન્ચુરીયન ડ્રાય / ગ્રેવી)	180	(300GM)
Veg. Spring Roll (વેજ. સ્પ્રિંગ રોલ)	220	(300GM)
Mushroom Chilly (Dry) (મશરૂમ ચીલી ડ્રાય)	220	(300GM)
Paneer Manchurian (Dry / Gravy) (પનીર મન્ચુરીયન ડ્રાય / ગ્રેવી)	200	(300GM)
Panner. 65 (પનીર. 65)	230	(300GM)
Veg. Crispy (વેજ. ક્રિસ્પી)	200	(300GM)
Veg. Hakka Noodles (વેજ. હક્કા નૂડલ્સ)	180	(300GM)
Veg. Manchurian Noodles (વેજ. મન્ચુરીયન નૂડલ્સ)	190	(300GM)
Veg. Schewan Noodles  (વેજ. શેઝવાન નૂડલ્સ)	190	(300GM)
Chinese Bhel (ચાઇનીઝ ભેળ)	200	(300GM)
Veg. Fried Rice (વેજ. ફ્રાઈડ રાઈસ)	180	(300GM)
Veg. Schewan Fried Rice  (વેજ. શેઝવાન ફ્રાઈડ રાઈસ)	190	(300GM)
Mushroom Fried Rice (મશરૂમ ફ્રાઈડ રાઈસ)	210	(300GM)
Manchurian Fried Rice (મન્ચુરીયન ફ્રાઈડ રાઈસ)	200	(300GM)

## SIZZLER



Sp. Excellency Sizzler (સ્પે. એક્સેલન્સી સીઝલર)	400	(300GM)
Chinese Sizzler (ચાઇનીઝ સીઝલર)	350	(300GM)
Veg. Grilled Sizzler (વેજ. ગ્રીલ્ડ સીઝલર)	350	(300GM)
Paneer Stick Sizzler (પનીર સ્ટીક સીઝલર)	400	(300GM)

## KOFTA



Sp. Excellency Kofta (Red + White Sweet) (સ્પે. એક્સેલન્સી કોફ્તા)	240	(300GM)
Cheese Kofta (ચીઝ કોફ્તા)	220	(300GM)
Malai Kofta (Sweet) (મલાઈ કોફ્તા સ્વીટ)	210	(300GM)
Kaju Kofta (કાજુ કોફ્તા)	220	(300GM)
Paneer Kofta 🍽️ (પનીર કોફ્તા)	210	(300GM)
Nargish Kofta (નરગીશ કોફ્તા)	200	(300GM)
Kashmiri Kofta (Sweet) (કાશ્મીરી કોફ્તા સ્વીટ)	210	(300GM)

## KAJU SPECIAL



Kaju Curry (કાજુ કરી)	220	(300GM)
Cheese Kaju (ચીઝ કાજુ)	230	(300GM)
Khoya Kaju Sweet (ખોયા કાજુ સ્વીટ)	230	(300GM)
Kaju Paneer Masala 🍽️ (કાજુ પનીર મસાલા)	220	(300GM)
Kaju Tawa Masala (કાજુ તવા મસાલા)	220	(300GM)
Kaju Handi (કાજુ હાંડી)	210	(300GM)

## PANEER



Paneer Angara 🍽️ (પનીર અંગારા)	240	(300GM)
Paneer Toofani 🍽️ (પનીર તુફાની)	230	(300GM)
Paneer Chatpata (પનીર ચટપટા)	220	(300GM)
Paneer Cycle (પનીર સાયકલ)	240	(300GM)
Paneer Pasanda (Red+Green) (પનીર પસંદા)	240	(300GM)
Paneer Patiyala (પનીર પટિયાલા)	230	(300GM)
Paneer Tikka Masala (પનીર ટીક્કા મસાલા)	210	(300GM)
Paneer Butter Masala (પનીર બટર મસાલા)	210	(300GM)
Paneer Cheese (પનીર ચીઝ)	220	(300GM)
Cheese Butter Masala (ચીઝ બટર મસાલા)	230	(300GM)
Paneer Bhurji (પનીર ભુરજી)	220	(300GM)
Paneer Kadai (પનીર કડાઈ)	210	(300GM)
Paneer Handi (પનીર હાંડી)	210	(300GM)
Paneer Tawa 🍽️ (પનીર તવા)	220	(300GM)
Paneer Balti (પનીર બાલ્ટી)	220	(300GM)
Paneer Shahi (પનીર શાહી)	200	(300GM)
Paneer Palak (પનીર પાલક)	190	(300GM)
Paneer Mutter (પનીર મટર)	190	(300GM)

## INDIAN VEG.



Sp. Excellency (સ્પે. એક્સેલન્સી)	240	(300GM)
Veg. Toofani 🍴 (વેજ. તુફાની)	230	(300GM)
Veg. Hungama (વેજ. હંગામા)	220	(300GM)
Veg. Hariyali Tadka (વેજ. હરિયાળી તડકા)	220	(300GM)
Veg. Kadai (વેજ. કડાઇ)	210	(300GM)
Veg. Handi (વેજ. હાંડી)	210	(300GM)
Veg. Hydrabadi (Green) (વેજ. હૈદરાબાદી)	210	(300GM)
Veg. Kolhapuri 🍴 (વેજ. કોલ્હાપુરી)	220	(300GM)
Veg. Jaipuri (વેજ. જયપુરી)	210	(300GM)
Veg. Makhanwala (વેજ મખનવાલા)	220	(300GM)
Navratna Korma (Sweet) (નવરત્ન કોરમા)	230	(300GM)
Mushroom Masala (મશરૂમ મસાલા)	220	(300GM)
Corn Palak (કોર્ન પાલક)	210	(300GM)
Dum Aloo (દમ આલુ)	200	(300GM)
Aloo Palak (આલુ પાલક)	170	(300GM)
Aloo Jeera (આલુ જીરા)	160	(300GM)
Plain Palak (પ્લેન પાલક)	150	(300GM)
Aloo Mutter (આલુ મટર)	150	(300GM)

Sev Tomato (સેવ ટોમેટો)	150	(300GM)
Bhindi Fry (ભીંડી ફ્રાય)	160	(300GM)
Bhindi Masala (ભીંડી મસાલા)	150	(300GM)
Dahi Fry (દહી ફ્રાય)	160	(300GM)
Suki Bhaji (સુકી ભાજી)	150	(300GM)
Mix Veg. (મીક્ષ વેજ.)	150	(300GM)
Chana Masala (ચના મસાલા)	150	(300GM)
Dal Fry (દાલ ફ્રાય)	120	(300GM)
Dal Fry tadka (દાલ ફ્રાય તડકા)	150	(300GM)
Dal Palak (દાલ પાલક)	170	(300GM)

## RICE / PULAV / BIRYANI



Sp. Excellency Pulav (સ્પે. એક્સેલન્સી પુલાવ)	200	(200GM)
Kashmiri Pulav (Sweet) (કાશ્મીરી પુલાવ સ્વીટ)	190	(200GM)
Kaju Pulav (કાજુ પુલાવ)	180	(200GM)
Paneer Pulav (પનીર પુલાવ)	180	(200GM)
Veg. Handi Pulav (વેજ. હાંડી પુલાવ)	190	(200GM)
Veg. Pulav (વેજ. પુલાવ)	170	(200GM)
Cheese Pulav (ચીઝ પુલાવ)	190	(200GM)

Veg. Biryani (વેજ. બિરયાની)	190	(200GM)
Hydrabadi Biryani (Green) (હૈદરાબાદી બિરયાની)	190	(200GM)
Masala Rice (મસાલા રાઇસ)	140	(200GM)
Jeera Rice (જીરા રાઇસ)	110	(200GM)
Steam Rice (સ્ટીમ રાઇસ)	100	(200GM)
Plain Rice (પ્લેન રાઇસ)	90	(200GM)

## INDIAN BREAD



Tandoori Roti (તંદૂરી રોટી)	20	(1PCS)
Tandoori Butter Roti (તંદૂરી બટર રોટી)	22	(1PCS)
Butter Naan (બટર નાન)	70	(1PCS)
Stuff Naan (સ્ટફ નાન)	110	(1PCS)
Cheese Naan (ચીઝ નાન)	110	(1PCS)
Garlic Naan (ગાર્લિક નાન)	100	(1PCS)
Garlic Cheese Naan (ગાર્લિક ચીઝ નાન)	120	(1PCS)
Stuff Parotha (સ્ટફ પરોઠા)	110	(1PCS)
Butter Kulcha (બટર કુલચા)	90	(1PCS)
Chapati (ચપાતી)	18	(1PCS)
Butter Chapati (બટર ચપાતી)	20	(1PCS)
Butter Chapati Parotha (બટર ચપાતી પરોઠા)	60	(1PCS)

## SNACKS



Aloo Parotha (આલુ પરોઠા)	110	(100GM)
Dahi Vada (દહી વડા)	80	(100GM)
Finger Chips (ફિંગર ચિપ્સ)	120	(100GM)
Paneer Pakoda (પનીર પકોડા)	140	(100GM)
Chana Puri (ચણા પુરી)	120	(100GM)
Sev Usal (સેવ ઉસળ)	80	(100GM)

## SANDWICH



Bread Butter (બ્રેડ બટર)	70	(30GM)
Bread Butter Jam (બ્રેડ બટર જામ)	80	(30GM)
Toast Butter (ટોસ્ટ બટર)	80	(30GM)
Toast Butter Jam (ટોસ્ટ બટર જામ)	90	(30GM)
Veg. Sandwich (વેજ. સેન્ડવીચ)	80	(40GM)
Veg. Grilled Sandwich (વેજ. ગ્રીલ્ડ સેન્ડવીચ)	100	(40GM)
Cheese Sandwich (ચીઝ સેન્ડવીચ)	100	(40GM)
Cheese Grilled Sandwich (ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ)	120	(40GM)
Aloo Mutter Sandwich (આલુ મટર સેન્ડવીચ)	90	(50GM)
Aloo Mutter Grilled Sandwich (આલુ મટર ગ્રીલ્ડ સેન્ડવીચ)	110	(50GM)
Veg. Cheese Sandwich (વેજ. ચીઝ સેન્ડવીચ)	110	(50GM)
Veg. Cheese Grilled Sandwich (વેજ. ચીઝ ગ્રીલ્ડ સેન્ડવીચ)	130	(50GM)

## SOUTH INDIAN



Excellency Dhosa (એક્સેલન્સી ઢોસા)	160	(250GM)
Masala Dhosa (મસાલા ઢોસા)	150	(250GM)
Cheese Masala Dhosa (ચીઝ મસાલા ઢોસા)	160	(200GM)
Paper Plain Dhosa (સાદા ઢોસા)	130	(150GM)
Paper Cheese Dhosa (સાદા ચીઝ ઢોસા)	140	(150GM)
Tomato Uttapam (ટોમેટો ઉત્તપમ)	170	(150GM)
Mix Uttapam (મિક્સ ઉત્તપમ)	170	(150GM)
Onion Uttapam (ઓનિયન ઉત્તપમ)	170	(150GM)
Masala Uttapam (મસાલા ઉત્તપમ)	160	(150GM)
Idli Sambar (ઇડલી સાંભાર)	110	(100GM)
Vada Sambhar (વડા સાંભાર)	110	(100GM)

## THALI



Fix Punjabi Thali (ફિક્સ પંજાબી થાળી)	180	(200GM)
--	-----	---------

પનીર-વેજ, દાળ-જીરા રાઈસ, તંદૂરી રોટી (૩ નંગ), સ્વીટ, પાપડ, છાશ

## COLD BEVERAGES



Sp. Butter Milk (સ્પે. છાશ)	35	(150ML)
Lassi Sweet (લસ્સી સ્વીટ)	90	(150ML)
Sp. Lassi (સ્પે. લસ્સી)	110	(150ML)
Cold Coffee (કોલ્ડ કોફી)	110	(150ML)
Milk Shake (મિલ્ક શેક)	120	(150ML)
Fresh Lime Water (ફ્રેશ લાઇમ વોટર)	40	(150ML)
Fresh Lime Soda (ફ્રેશ લાઇમ સોડા)	50	(150ML)
Ice - Cream / Cold Drink (આઈસક્રીમ / કોલ્ડ ડ્રીન્ક)	MRP	

## NOTES

JAIN FOOD IS ALSO AVAILABLE.  
ORDER ONCE PLACED CANNOT BE CANCELLED.  
GUESTS ARE REQUESTED TO WAIT FEW MINUTES AFTER PLACING THE ORDER.  
CONSUMPTION OF ALCOHOLIC BEVERAGES IS STRICTLY PROHIBITED.  
THANK YOU FOR YOUR CO-OPERATION.  
GIVE YOUR PRECIOUS FEEDBACK & SUGGESTIONS OVER THE COUNTER.